

અંતરશુદ્ધિનાં સોપાન
શ્રીગુરુમાર્ગ દ્વારા લિખિત પુસ્તકમાંથી
ઉદ્ધરણ ૧૪

જ્યારે કોઈ દુઃખી હોય ત્યારે તમે ખરેખર શું અનુભવો છો? શું તમે માત્ર એમ કહો છો, “અરે, મને તારા માટે દુઃખ થાય છે. કાશ તારી સાથે આવું ન થયું હોત.” અથવા શું તમે મદદ કરવા હાથ લંબાવો છો? જો તમે ખરેખર મદદ કરવાનો પ્રયત્ન કરો અને બદલામાં કોઈ વસ્તુની આશા રાખો તો તે શું છે?



© ૨૦૨૨ એસ.વાય.ડી.એ. ફાઉન્ડેશન®. સર્વાધિકાર સુરક્ષિત.

ગુરુમાર્ગ ચિદ્વિલાસાનંદ, અંતરશુદ્ધિનાં સોપાન : દિવ્ય સદ્ગુણોનો યોગ, અધ્યાય ૭, ‘કરુણા’માંથી (ચિત્શક્તિ પબ્લિકેશન્સ, ચેન્નઈ, ૨૦૧૩),
પૃષ્ઠ ૯૯.